

1લી જાન્યુઆરી, 2025 એકીકૃત બચત ખાતા માટે સુવિધાઓ અને ફીની પ્રભાવી સામાન્ય સૂચિ (ભાગ 1)

વિવરણ		કોટક એસ સેર્વિસ/પગાર ખાતું			કોટક પ્રો બચત ખાતું	કોટક કલાસિક બચત ખાતું	કોટક એફજી બચત/પગાર ખાતું		કોટક નોવા બચત ખાતું	કોટક સંકલ્પ બચત ખાતું	કોટક સન્માન બચત ખાતું	યુ એન આઈ ખાતું	પ્લેટિના પગાર ખાતું	કોટક રોજિંદી બચત / પગાર ખાતું		નેશન મિલ્ડર પગાર ખાતું	સિનર્જી બચત ખાતું
		અભ્ય બચત ખાતું	એસ પગાર ખાતું	ગણપેશધારી દળો માટે પગાર ખાતું			એફજી બચત ખાતું	એફજી પગાર ખાતું						ટૅબિક બચત ખાતું	ટૅબિક પગાર ખાતું		
એ એમ બી (સરેરાશ માસિક બેલેન્સ)		સરેરાશ માસિક બેલેન્સ (એ એમ બી) ભારતીય રૂપિયા 50,000			શૂન્ય	સરેરાશ માસિક બેલેન્સ (એ એમ બી) ભારતીય રૂપિયા 20,000	સરેરાશ માસિક બેલેન્સ (એ એમ બી) ભારતીય રૂપિયા 10,000		સરેરાશ માસિક બેલેન્સ (એ એમ બી) ભારતીય રૂપિયા 5,000	સરેરાશ ત્રિમાસિક બેલેન્સ (AOB) ભારતીય રૂપિયા 2,000		શૂન્ય	સરેરાશ માસિક બેલેન્સ (એ એમ બી) ભારતીય રૂપિયા 1,00,000	સરેરાશ માસિક બેલેન્સ (એ એમ બી) ભારતીય રૂપિયા 10,000	સરેરાશ માસિક બેલેન્સ (એ એમ બી) ભારતીય રૂપિયા 10,000	શૂન્ય	સરેરાશ માસિક બેલેન્સ (એ એમ બી) ભારતીય રૂપિયા 5,000
બિન જાળવણી ફી	ન્યૂનતમ માસિક સરેરાશ સંતુલનની બિન-જાળવણી માટે શુલ્ક	એ એમ બીમાં દર મહિને 6% ઘટાડો જરૂરી છે (મહત્તમ ભારતીય રૂપિયા 600/- સુધી)	જો પગાર પ્રાપ્ત ન થયો હોય અથવા લાગલગાટ 2 મહિના માટે પ્રોડક્ટની એ એમ બી જાળવણી ન કરી હોય તો, ન્યૂનતમ માસિક સરેરાશ સંતુલનની બિન જાળવણી માટે શુલ્ક લાગુ પડશે^	શૂન્ય#	એ એમ બીમાં દર મહિને 6% ઘટાડો જરૂરી છે (મહત્તમ ભારતીય રૂપિયા 600/- સુધી)	એ એમ બીમાં દર મહિને 6% ઘટાડો જરૂરી છે (મહત્તમ ભારતીય રૂપિયા 500/- સુધી)	એ એમ બીમાં દર મહિને 6% ઘટાડો જરૂરી છે (મહત્તમ ભારતીય રૂપિયા 500/- સુધી)	જો પગાર પ્રાપ્ત ન થયો હોય અથવા લાગલગાટ 2 મહિના માટે પ્રોડક્ટની એ એમ બી જાળવણી ન કરી હોય તો, ન્યૂનતમ માસિક સરેરાશ સંતુલનની બિન જાળવણી માટે શુલ્ક લાગુ પડશે^	એ એમ બીમાં દર મહિને 6% ઘટાડો જરૂરી છે (મહત્તમ ભારતીય રૂપિયા 250/- સુધી)	પ્રતિ ત્રિમાસિક આવશ્યક અચર્યામાં 6% ઘટાડો (મહત્તમ ભારતીય રૂપિયા 125/- સુધી)	ત્રિમાસિક દીઠ આવશ્યક AOBમાં 6% ઘટાડો (મહત્તમ ભારતીય રૂપિયા 100/- સુધી)		શૂન્ય	જો પગાર પ્રાપ્ત ન થયો હોય અથવા લાગલગાટ 2 મહિના માટે પ્રોડક્ટની એ એમ બી જાળવણી ન કરી હોય તો, ન્યૂનતમ માસિક સરેરાશ સંતુલનની બિન જાળવણી માટે શુલ્ક લાગુ પડશે^	એ એમ બીમાં દર મહિને 6% ઘટાડો જરૂરી છે (મહત્તમ ભારતીય રૂપિયા 500/- સુધી)	જો પગાર પ્રાપ્ત ન થયો હોય અથવા લાગલગાટ 2 મહિના માટે પ્રોડક્ટની એ એમ બી જાળવણી ન કરી હોય તો, ન્યૂનતમ માસિક સરેરાશ સંતુલનની બિન જાળવણી માટે શુલ્ક લાગુ પડશે^	એ એમ બીમાં દર મહિને 6% ઘટાડો જરૂરી છે (મહત્તમ ભારતીય રૂપિયા 250/- સુધી)
રોકડ ટ્રાન્ઝેક્શન્સ પર શુલ્ક	શાખા / રોકડ જમા મશીન (એ ટી એમ) ખાતે રોકડ ટ્રાન્ઝેક્શન (જમા અથવા ઉપાડ)	5 ટ્રાન્ઝેક્શન્સ અથવા ભારતીય રૂપિયા 5 લાખ/મહિને બેમાંથી જે વહેતું હોય, ત્યાં સુધી શૂન્ય. આ સીમાઓ ઉપરાંત, ભારતીય રૂપિયા 5/1000 (ન્યૂનતમ ભારતીય રૂપિયા 150) પર શુલ્ક લાગુ			**5 ટ્રાન્ઝેક્શન્સ અથવા ભારતીય રૂપિયા 2 લાખ/મહિને બેમાંથી જે વહેતું હોય, ત્યાં સુધી શૂન્ય. આ સીમાઓ ઉપરાંત, ભારતીય રૂપિયા 5/1000 (ન્યૂનતમ ભારતીય રૂપિયા 150) પર શુલ્ક લાગુ			**4 ટ્રાન્ઝેક્શન્સ અથવા ભારતીય રૂપિયા 2 લાખ/મહિને બેમાંથી જે વહેતું હોય, ત્યાં સુધી શૂન્ય. આ સીમાઓ ઉપરાંત, ભારતીય રૂપિયા 5/1000 (ન્યૂનતમ ભારતીય રૂપિયા 150) પર શુલ્ક લાગુ			ભારતીય રૂપિયા 24 લાખ/વર્ષ સુધી સંચિત (ક્યુચ્યુલેટિવ) શૂન્ય આ સીમાઓ ઉપરાંત, ભારતીય રૂપિયા 250/- અથવા ભારતીય રૂપિયા 125/- સુધી	**4 ટ્રાન્ઝેક્શન્સ સુધી અથવા 1.5 લાખ/મહિના, બેમાંથી જે વહેતું હોય ત્યાં સુધી શૂન્ય, ત્યારબાદ ભારતીય રૂપિયા 5 / 1000 (ન્યૂનતમ ભારતીય રૂપિયા 150)	5 ટ્રાન્ઝેક્શન્સ અથવા ભારતીય રૂપિયા 5 લાખ/મહિને બેમાંથી જે વહેતું હોય, ત્યાં સુધી શૂન્ય. આ સીમાઓ ઉપરાંત, ભારતીય રૂપિયા 5/1000 (ન્યૂનતમ ભારતીય રૂપિયા 150) પર શુલ્ક લાગુ	**4 ટ્રાન્ઝેક્શન્સ અથવા ભારતીય રૂપિયા 2 લાખ/મહિને બેમાંથી જે વહેતું હોય, ત્યાં સુધી શૂન્ય. આ સીમાઓ ઉપરાંત, ભારતીય રૂપિયા 5/1000 (ન્યૂનતમ ભારતીય રૂપિયા 150) પર શુલ્ક લાગુ		30 ટ્રાન્ઝેક્શન્સ સુધી અથવા 2 લાખ/મહિને બેમાંથી જે વહેતું હોય ત્યાં સુધી શૂન્ય. આ સીમાઓ ઉપરાંત, ભારતીય રૂપિયા 5 / 1000 (ન્યૂનતમ ભારતીય રૂપિયા 150) સુધી શુલ્ક લાગુ ભારતીય રૂપિયા 2 લાખ / મહિના સુધીની રોકડ રકમ જમા પર નિ:શુલ્ક . આ સીમાઓ ઉપરાંત, ભારતીય રૂપિયા 5/1000 (ન્યૂનતમ ભારતીય રૂપિયા 150) શુલ્ક લાગુ	**4 ટ્રાન્ઝેક્શન્સ અથવા 2 લાખ/મહિનો, બેમાંથી જે વહેતું હોય તેના પર શૂન્ય લાગુ. આ સીમાઓ ઉપરાંત, ભારતીય રૂપિયા 5/1000 (ન્યૂનતમ ભારતીય રૂપિયા 150) પર શુલ્ક લાગુ
ડેબિટ કાર્ડ / એ ટી એમ વપરાશ ફી	કોટક બેંકનું એ ટી એમ -રોકડ ઉપાડ / બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ	દર મહિને 30 લેવડેવડ સુધી કોઈ શુલ્ક નહીં, (કોટક એટીએમ + અન્ય બેંક એટીએમ પર નાણાકીય + બિન-નાણાકીય) ત્યારબાદ નાણાકીય લેવડેવડ દીઠ ભારતીય રૂપિયા 21 અને બિન-નાણાકીય લેવડેવડ દીઠ ભારતીય રૂપિયા 8.5			દર મહિને 30 લેવડેવડ સુધી કોઈ શુલ્ક નહીં, (કોટક એટીએમ + અન્ય બેંક એટીએમ પર નાણાકીય + બિન-નાણાકીય) ત્યારબાદ નાણાકીય લેવડેવડ દીઠ ભારતીય રૂપિયા 21 અને બિન-નાણાકીય લેવડેવડ દીઠ ભારતીય રૂપિયા 8.5			દર મહિને 5 નાણાકીય અને શૂન્ય શુલ્ક, ત્યારબાદ નાણાકીય લેવડેવડ દીઠ ભારતીય રૂપિયા 21 અને બિન-નાણાકીય લેવડેવડ દીઠ ભારતીય રૂપિયા 8.5	દર મહિને 5 નાણાકીય અને બિન-નાણાકીય લેવડેવડ સુધી શૂન્ય શુલ્ક, ત્યારબાદ નાણાકીય લેવડેવડ દીઠ ભારતીય રૂપિયા 21 અને બિન-નાણાકીય લેવડેવડ દીઠ ભારતીય રૂપિયા 8.5			દર મહિને 30 લેવડેવડ સુધી કોઈ શુલ્ક નહીં, (કોટક એટીએમ + અન્ય બેંક એટીએમ પર નાણાકીય + બિન-નાણાકીય) ત્યારબાદ નાણાકીય લેવડેવડ દીઠ ભારતીય રૂપિયા 21 અને બિન-નાણાકીય લેવડેવડ દીઠ ભારતીય રૂપિયા 8.5		દર મહિને 7 લેવડેવડ સુધી કોઈ શુલ્ક નહીં (નાણાકીય + બિન-નાણાકીય), ત્યારબાદ નાણાકીય ટ્રાન્ઝેક્શન દીઠ ભારતીય રૂપિયા 21 અને બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન દીઠ ભારતીય રૂપિયા 8.5	દર મહિને 10 લેવડેવડ સુધી કોઈ શુલ્ક નહીં (નાણાકીય + બિન-નાણાકીય), ત્યારબાદ નાણાકીય ટ્રાન્ઝેક્શન દીઠ ભારતીય રૂપિયા 21 અને બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન દીઠ ભારતીય રૂપિયા 8.5	શૂન્ય	દર મહિને 5 નાણાકીય અને બિન-નાણાકીય લેવડેવડ સુધી શૂન્ય શુલ્ક, ત્યારબાદ નાણાકીય લેવડેવડ દીઠ ભારતીય રૂપિયા 21 અને બિન-નાણાકીય લેવડેવડ દીઠ ભારતીય રૂપિયા 8.5
	અન્ય ડોમેસ્ટિક એટીએમ – રોકડ ઉપાડ / નોન નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ##							3 ટ્રાન્ઝેક્ષનત સુધી શૂન્ય (ટોચના 6 શહેરોમાં##*) અને 5 ટ્રાન્ઝેક્શન (નોન-ટોપ સિટીઝ) ત્યાર બાદ રોકડ ઉપાડ દીઠ ભારતીય રૂપિયા 21 અને બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન દીઠ ભારતીય રૂપિયા 8.5						શૂન્ય		શૂન્ય 3 ટ્રાન્ઝેક્ષનત (ટોચનાં 6 શહેરોમાં##*) અને 5 ટ્રાન્ઝેક્શન (નોન-ટોપ સિટીઝ) દર મહિને ત્યાર બાદ રોકડ ઉપાડ દીઠ ભારતીય રૂપિયા 21અન બિન –નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ દીઠ ભારતીય રૂપિયા 8.5	
	અપર્યાપ્ત ભંડોળના કારણસર આઉટલેટ્સ / વેબસાઈટ્સ / એટીએમ ખાતે ટ્રાન્ઝેક્શન્સ અસ્વીકૃત થયા હોય<>	નોન કોટક એટીએમ પર 25 ભારતીય રૂપિયા			નોન કોટક એટીએમ પર 25 ભારતીય રૂપિયા			નોન કોટક એટીએમ પર 25 ભારતીય રૂપિયા			નોન કોટક એટીએમ પર 25 ભારતીય રૂપિયા			નોન કોટક એટીએમ પર 25 ભારતીય રૂપિયા		નોન કોટક એટીએમ પર 25 ભારતીય રૂપિયા	
	આંતરરાષ્ટ્રીય એટીએમ + ખાતે રોકડ ઉપાડ / બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન્સ	રોકડ ઉપાડના ટ્રાન્ઝેક્શન દીઠ ભારતીય રૂપિયા 150 અને બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન દીઠ ભારતીય રૂપિયા 25			રોકડ ઉપાડના ટ્રાન્ઝેક્શન દીઠ ભારતીય રૂપિયા 150 અને બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન દીઠ ભારતીય રૂપિયા 25			રોકડ ઉપાડના ટ્રાન્ઝેક્શન દીઠ ભારતીય રૂપિયા 150 અને બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન દીઠ ભારતીય રૂપિયા 25			રોકડ ઉપાડના ટ્રાન્ઝેક્શન દીઠ ભારતીય રૂપિયા 150 અને બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન દીઠ ભારતીય રૂપિયા 25			રોકડ ઉપાડના ટ્રાન્ઝેક્શન દીઠ ભારતીય રૂપિયા 150 અને બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન દીઠ ભારતીય રૂપિયા 25		રોકડ ઉપાડના ટ્રાન્ઝેક્શન દીઠ ભારતીય રૂપિયા 150 અને બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન દીઠ ભારતીય રૂપિયા 25	
	કાર્ડલેસ રોકડ ઉપાડ (આઈ એમ ટી)	દર મહિને 1 ટ્રાન્ઝેક્શન શૂન્ય અને ત્યારપછીના ટ્રાન્ઝેક્શન પર પ્રતિ ટ્રાન્ઝેક્શન માટે ભારતીય રૂપિયા 10/- ચાર્જ કરવામાં આવશે			દર મહિને 1 ટ્રાન્ઝેક્શન શૂન્ય અને ત્યારપછીના ટ્રાન્ઝેક્શન પર પ્રતિ ટ્રાન્ઝેક્શન માટે ભારતીય રૂપિયા 10/- ચાર્જ કરવામાં આવશે			દર મહિને 1 ટ્રાન્ઝેક્શન શૂન્ય અને ત્યારપછીના ટ્રાન્ઝેક્શન પર પ્રતિ ટ્રાન્ઝેક્શન માટે ભારતીય રૂપિયા 10/- ચાર્જ કરવામાં આવશે			દર મહિને 1 ટ્રાન્ઝેક્શન શૂન્ય અને ત્યારપછીના ટ્રાન્ઝેક્શન પર પ્રતિ ટ્રાન્ઝેક્શન માટે ભારતીય રૂપિયા 10/- ચાર્જ કરવામાં આવશે			દર મહિને 1 ટ્રાન્ઝેક્શન શૂન્ય અને ત્યારપછીના ટ્રાન્ઝેક્શન પર પ્રતિ ટ્રાન્ઝેક્શન માટે ભારતીય રૂપિયા 10/- ચાર્જ કરવામાં આવશે		દર મહિને 1 ટ્રાન્ઝેક્શન શૂન્ય અને ત્યારપછીના ટ્રાન્ઝેક્શન પર પ્રતિ ટ્રાન્ઝેક્શન માટે ભારતીય રૂપિયા 10/- ચાર્જ કરવામાં આવશે	
ડીડી / ચેક બુક	ડીડી	શૂન્ય ભારતીય રૂપિયા 1 લાખ સુધી; આ મર્યાદાઓ પોસ્ટ કરો: ભારતીય રૂપિયા 4/1000 (ન્યૂનતમ ભારતીય રૂપિયા 50, મહત્તમ ભારતીય રૂપિયા 10,000) વરિષ્ઠ નાગરિક માટે ભારતીય રૂપિયા 3 / 1000			ભારતીય રૂપિયા 4/1000 (ન્યૂનતમ ભારતીય રૂપિયા 50, મહત્તમ ભારતીય રૂપિયા 10,000), વરિષ્ઠ નાગરિક માટે ભારતીય રૂપિયા 3 / 1000						શૂન્ય			શૂન્ય		ભારતીય રૂપિયા 4/1000 (ન્યૂનતમ ભારતીય રૂપિયા 50, મહત્તમ ભારતીય રૂપિયા 10,000), વરિષ્ઠ નાગરિક માટે ભારતીય રૂપિયા 3 / 1000	
	એક સી વાય – ડી ડી/ ટી ટી/ચેક કલેક્શન/ પુનઃપ્રમાણિકતા/રદ/ એફ સી વાય ચેક જમા અને પરત	ભારતીય રૂપિયા 500 / ઘટના			ભારતીય રૂપિયા 500 / ઘટના			ભારતીય રૂપિયા 500 / ઘટના			ભારતીય રૂપિયા 500 / ઘટના			ભારતીય રૂપિયા 500 / ઘટના		ભારતીય રૂપિયા 500 / ઘટના	
	એટ-પાર ચેક બુક શુલ્ક	**100 ચેક શૂન્ય/વર્ષ; ત્યારબાદ ભારતીય રૂપિયા 3/ચેક પૃષ્ઠ.	શૂન્ય	**દર વર્ષે 100 ચેક પૃષ્ઠ સુધી મફત પછી ભારતીય રૂપિયા 3/ચેક પૃષ્ઠ	દર વર્ષે 25 ચેક પૃષ્ઠ સુધી મફત પછી ભારતીય રૂપિયા 3/ચેક પૃષ્ઠ			દર વર્ષે 10 ચેક પૃષ્ઠ સુધી મફત પછી ભારતીય રૂપિયા 3/ચેક પૃષ્ઠ			દર વર્ષે 15 ચેક પાનાંઓ સુધી મફત; 25 ચેક પાનાંઓ માટે ભારતીય રૂપિયા 75; 50 ચેક પાનાંઓ માટે ભારતીય રૂપિયા 150 (ત્યારબાદ પ્રતિ ચેક પાના દીઠ ભારતીય રૂપિયા 3)	શૂન્ય	**દર વર્ષે 100 ચેક પૃષ્ઠ સુધી મફત પછી ભારતીય રૂપિયા 3/ચેક પૃષ્ઠ	શૂન્ય	દર વર્ષે 25 ચેક પૃષ્ઠ સુધી મફત પછી ભારતીય રૂપિયા 3/ચેક પૃષ્ઠ		
ટ્રાન્ઝેક્શન નિષ્ફળતા	ઈ સી એસ/ ચેક જારી અને પરત (ફંડની ઉપલબ્ધતાને કારણે)	ભારતીય રૂપિયા 500 / ઘટના			ભારતીય રૂપિયા 500 / ઘટના			ભારતીય રૂપિયા 500 / ઘટના			ભારતીય રૂપિયા 500 / ઘટના			ભારતીય રૂપિયા 500 / ઘટના		ભારતીય રૂપિયા 500 / ઘટના	
	ઈ સી એસ આદેશ ચકાસણી	શૂન્ય	શૂન્ય	શૂન્ય	શૂન્ય			ભારતીય રૂપિયા 50 / ઘટના			શૂન્ય			શૂન્ય		ભારતીય રૂપિયા 50 / ઘટના	
	એસ આઈ નિષ્ફળતા	ભારતીય રૂપિયા 100/ઘટના	ભારતીય રૂપિયા 100/ઘટના	ભારતીય રૂપિયા 100/ઘટના	ભારતીય રૂપિયા 100/ઘટના			ભારતીય રૂપિયા 100/ઘટના			ભારતીય રૂપિયા 100/ઘટના			ભારતીય રૂપિયા 100/ઘટના		ભારતીય રૂપિયા 100/ઘટના	
	ચેક જમા કરાવ્યો અને પાછો ફર્યો (ભારતીય રૂપિયા)	ભારતીય રૂપિયા 200 / ઘટના			ભારતીય રૂપિયા 200 / ઘટના			ભારતીય રૂપિયા 200 / ઘટના			ભારતીય રૂપિયા 200 / ઘટના			ભારતીય રૂપિયા 200 / ઘટના		ભારતીય રૂપિયા 200 / ઘટના	
	બિન-નાણાકીય કારણોસર ચેક જારી અને પરત કરવામાં આવ્યો	ભારતીય રૂપિયા 50 / ઘટના			ભારતીય રૂપિયા 50 / ઘટના			ભારતીય રૂપિયા 50 / ઘટના			ભારતીય રૂપિયા 50 / ઘટના			ભારતીય રૂપિયા 50 / ઘટના		ભારતીય રૂપિયા 50 / ઘટના	
ડેબિટ કાર્ડની વાર્ષિક ફી / જારી કરવાની ફી	પે શોપ મોર ડેબિટ કાર્ડ / ડ્રીમ ફિક્શન્ટ 811 ડેબિટ કાર્ડ	શૂન્ય	ભારતીય રૂપિયા 259		શૂન્ય			ભારતીય રૂપિયા 259			1લા વર્ષ માટે શૂન્ય, ત્યારબાદ ભારતીય રૂપિયા 199 પ્રતિ વર્ષ			ભારતીય રૂપિયા 259		શૂન્ય	ભારતીય રૂપિયા 259
	સિલ્ક ડેબિટ કાર્ડ	શૂન્ય	ભારતીય રૂપિયા 259	શૂન્ય	ભારતીય રૂપિયા 259			ભારતીય રૂપિયા 259			ભારતીય રૂપિયા 259*			ભારતીય રૂપિયા 259		ભારતીય રૂપિયા 259	
	વિઝા પ્લેટિનમ / માય વર્લ્ડ ડેબિટ કાર્ડ	શૂન્ય	ભારતીય રૂપિયા 750	નિયમિત પગાર / પેન્શન જમા થવાની શરતે શૂન્ય. અન્યથા ભારતીય રૂપિયા 750.	1લા વર્ષ માટે શૂન્ય, ત્યારબાદ ભારતીય રૂપિયા 259 પ્રતિ વર્ષ			ભારતીય રૂપિયા 750			ભારતીય રૂપિયા 750			એન.એ.		નિયમિત પગાર / પેન્શન જમા થવાની શરતે શૂન્ય. અન્યથા ભારતીય રૂપિયા 750.	
	કોટક પીવીઆર ડેબિટ કાર્ડ	ભારતીય રૂપિયા 499	શૂન્ય	ભારતીય રૂપિયા 499	ભારતીય રૂપિયા 499			ભારતીય રૂપિયા 499	શૂન્ય	ભારતીય રૂપિયા 499	ભારતીય રૂપિયા 499		શૂન્ય	ભારતીય રૂપિયા 499	ભારતીય રૂપિયા 499		
	એવરીડે ડેબિટ કાર્ડ	ભારતીય રૂપિયા 259*			ભારતીય રૂપિયા 259			ભારતીય રૂપિયા 259			ભારતીય રૂપિયા 259			ભારતીય રૂપિયા 259		ભારતીય રૂપિયા 259	
	વિઝા સિગ્નેચર પ્રો ડેબિટ કાર્ડ	ભારતીય રૂપિયા 750			ભારતીય રૂપિયા 750			ભારતીય રૂપિયા 750			ભારતીય રૂપિયા 750			ભારતીય રૂપિયા 750*		ભારતીય રૂપિયા 750*	
	પ્રિવી લીગ પ્લેટિનમ કાર્ડ	ભારતીય રૂપિયા 750			ભારતીય રૂપિયા 750			ભારતીય રૂપિયા 750			ભારતીય રૂપિયા 750			ભારતીય રૂપિયા 750		ભારતીય રૂપિયા 750	
	પ્રિવી લીગ સિગ્નેચર કાર્ડ	ભારતીય રૂપિયા 750			ભારતીય રૂપિયા 750			ભારતીય રૂપિયા 750			ભારતીય રૂપિયા 750			ભારતીય રૂપિયા 750		ભારતીય રૂપિયા 750	
	પ્રિવી લીગ બિઝનેસ કાર્ડ	ભારતીય રૂપિયા 750			ભારતીય રૂપિયા 750			ભારતીય રૂપિયા 750			ભારતીય રૂપિયા 750			ભારતીય રૂપિયા 750		ભારતીય રૂપિયા 750	

ડેબિટ કાર્ડની વાર્ષિક ફી / જારી કરવાની ફી	પ્રિવી લીગ નિયોન ડેબિટ કાર્ડ	ભારતીય રૂપિયા 1500		ભારતીય રૂપિયા 1500		ભારતીય રૂપિયા 1500		ભારતીય રૂપિયા 1500		ભારતીય રૂપિયા 1500		ભારતીય રૂપિયા 1500									
	પ્રિવી લીગ LED ડેબિટ કાર્ડ	ભારતીય રૂપિયા 2500		ભારતીય રૂપિયા 2500		ભારતીય રૂપિયા 2500		ભારતીય રૂપિયા 2500		ભારતીય રૂપિયા 2500		ભારતીય રૂપિયા 2500									
	પ્રિવી લીગ બ્લેક મેટલ ડેબિટ કાર્ડ	ભારતીય રૂપિયા 5000		ભારતીય રૂપિયા 5000		ભારતીય રૂપિયા 5000		ભારતીય રૂપિયા 5000		ભારતીય રૂપિયા 5000		ભારતીય રૂપિયા 5000									
	ખાનગી બેંકિંગ ઇન્ફ્રનિટ ડેબિટ કાર્ડ	ભારતીય રૂપિયા 1500		ભારતીય રૂપિયા 1500		ભારતીય રૂપિયા 1500		ભારતીય રૂપિયા 1500		ભારતીય રૂપિયા 1500		ભારતીય રૂપિયા 1500									
	Goqii વેરબલ પેમેન્ટ	ઇશ્યુ કરવાની ફી – INR 3499 અને વાર્ષિક ફી – INR 259 બીજા વર્ષથી			ઇશ્યુ કરવાની ફી – INR 3499 અને વાર્ષિક ફી – INR 259 બીજા વર્ષથી			ઇશ્યુ કરવાની ફી – INR 3499 અને વાર્ષિક ફી – INR 259 બીજા વર્ષથી			ઇશ્યુ કરવાની ફી – INR 3499 અને વાર્ષિક ફી – INR 259 બીજા વર્ષથી										
	ડિજીટલ કાર્ડ	વિઝા પ્લેટિનમ ડેબિટ કાર્ડ		વિઝા પ્લેટિનમ ડેબિટ કાર્ડ		પે શોપ મોર ડેબિટ કાર્ડ		પે શોપ મોર ડેબિટ કાર્ડ		વિઝા પ્લેટિનમ ડેબિટ કાર્ડ		એવરીડે ડેબિટ કાર્ડ		પ્લેટિનમ ડેબિટ કાર્ડ		વિઝા પ્લેટિનમ ડેબિટ કાર્ડ					
ફંડ ટ્રાન્સફર	NEFT / RTGS / ફંડ ટ્રાન્સફર (નેટબેંકિંગ / મોબાઇલ બેન્કિંગ દ્વારા)	શૂન્ય			શૂન્ય			શૂન્ય			શૂન્ય			શૂન્ય			શૂન્ય				
	NEFT / RTGS – જો શાખામાં કરવામાં આવે તો જ લાગુ	શૂન્ય			શૂન્ય			NEFT: 10,000 સુધી: ભારતીય રૂપિયા 2; 10,001 થી 1,00,000: ભારતીય રૂપિયા4; 1,00,001 થી 2,00,000: ભારતીય રૂપિયા14; 2,00,000: ભારતીય રૂપિયા 24 ; RTGS: 2,00,000 થી 5,00,000: ભારતીય રૂપિયા 20; 5,00,000: ભારતીય રૂપિયા 40			શૂન્ય			NEFT: 10,000 સુધી: ભારતીય રૂપિયા 2; 10,001 થી 1,00,000: ભારતીય રૂપિયા4; 1,00,001 થી 2,00,000: ભારતીય રૂપિયા14; 2,00,000: ભારતીય રૂપિયા 24 ; RTGS: 2,00,000 થી 5,00,000: ભારતીય રૂપિયા 20; 5,00,000: ભારતીય રૂપિયા 40			NEFT: 10,000 સુધી: ભારતીય રૂપિયા 2; 10,001 થી 1,00,000: ભારતીય રૂપિયા4; 1,00,001 થી 2,00,000: ભારતીય રૂપિયા14; 2,00,000: ભારતીય રૂપિયા 24 ; RTGS: 2,00,000 થી 5,00,000: ભારતીય રૂપિયા 20; 5,00,000: ભારતીય રૂપિયા 40				
	IMPS	શૂન્ય			શૂન્ય			10,000 સુધી: ભારતીય રૂપિયા 5; 10,001 થી 1,00,000: ભારતીય રૂપિયા 5; 1,00,001 થી 5,00,000: ભારતીય રૂપિયા 15			શૂન્ય			શૂન્ય			10,000 સુધી: ભારતીય રૂપિયા 5; 10,001 થી 1,00,000: ભારતીય રૂપિયા 5; 1,00,001 થી 5,00,000: ભારતીય રૂપિયા 15				
શાખા વિનંતી	કુપ્લિકેટ એડ–હોક સ્ટેટમેન્ટ, કુપ્લિકેટ પાસબુક, શાખા દ્વારા ટીડીએસ પ્રમાણપત્ર અથવા અન્ય કોઈપણ રેકૉર્ડ પુનઃપ્રાપ્તિ, સ્ટોપ પેમેન્ટ – શાખા દ્વારા એકલ / શ્રેણીબદ્ધ ચેક; ડીડી રીવેલિડેશન; પીઓ / બીસી પુનઃપ્રમાણ / રદ્દીકરણ (આઇએનઆર); વાર્ષિક જોઇન્ટ સ્ટેટમેન્ટ–ભૌતિક; માસિક ભૌતિક નિવેદન;	શૂન્ય			શૂન્ય			ભારતીય રૂપિયા 100/ વિનંતી, વરિષ્ઠ નાગરિકો માટે: ભારતીય રૂપિયા 75/ વિનંતી			ભારતીય રૂપિયા 100/ વિનંતી, વરિષ્ઠ નાગરિકો માટે: ભારતીય રૂપિયા 75/ વિનંતી			શૂન્ય			ભારતીય રૂપિયા 100/ વિનંતી, વરિષ્ઠ નાગરિકો માટે: ભારતીય રૂપિયા 75/ વિનંતી				
	ડીડી કેન્સલેશન (ભારતીય રૂપિયા)	શૂન્ય			શૂન્ય			વરિષ્ઠ નાગરિકો માટે ભારતીય રૂપિયા 100/ વિનંતી: શૂન્ય			વરિષ્ઠ નાગરિકો માટે ભારતીય રૂપિયા 100/ વિનંતી: શૂન્ય			શૂન્ય			ભારતીય રૂપિયા 100/ વિનંતી				
	વિદેશી ઇનવર્ડ રેમિટન્સ પ્રમાણપત્ર	શૂન્ય			શૂન્ય			ભારતીય રૂપિયા 100/ વિનંતી			ભારતીય રૂપિયા 100/ વિનંતી			શૂન્ય			ભારતીય રૂપિયા 100/ વિનંતી				
ફેમિલી બેંકિંગ	-	એન.એ.	એમએમસીએ એફ એસ એ માફ કર્યું			એન.એ.			એમએમસીએ એફ એસ એ માફ કર્યું	એન.એ.			એન.એ.	એમએમસીએ એફ એસ એ માફ કર્યું	માય ફેમિલી બેંકિંગ મુજબ લાગુ	એમએમસીએ એફ એસ એ માફ કર્યું			એન.એ.		
નિવેદનો અને ચેતવણીઓ	સ્ટેટમેન્ટ્સ	ઇમેલ સ્ટેટમેન્ટ (માસિક): શૂન્ય; ભૌતિક નિવેદન (ત્રિમાસિક): શૂન્ય				ઇમેલ સ્ટેટમેન્ટ (માસિક): શૂન્ય; ભૌતિક નિવેદન (ત્રિમાસિક): શૂન્ય				ઇમેલ સ્ટેટમેન્ટ (માસિક): શૂન્ય; ભૌતિક નિવેદન (ત્રિમાસિક): શૂન્ય				ઇમેલ સ્ટેટમેન્ટ (માસિક): શૂન્ય; ભૌતિક નિવેદન (ત્રિમાસિક): શૂન્ય							
	બેલેન્સ મૂલ્ય ઉમેરાયેલ ચેતવણીઓ (દૈનિક / સાપ્તાહિક)	**50 પૃષ્ઠ પ્રતિ ભારતીય રૂપિયા (દૈનિક) અને સાપ્તાહિક– શૂન્ય				50 પૃષ્ઠ પ્રતિ એસ એમ એસ (દૈનિક/સાપ્તાહિક)				50 પૃષ્ઠ પ્રતિ એસ એમ એસ (દૈનિક/સાપ્તાહિક)				**50 પૃષ્ઠ પ્રતિ એસ એમ એસ (દૈનિક/સાપ્તાહિક) – શૂન્ય				**50 પૃષ્ઠ પ્રતિ એસ એમ એસ (દૈનિક/સાપ્તાહિક)	**50 પૃષ્ઠ પ્રતિ ભારતીય રૂપિયા (દૈનિક) અને સાપ્તાહિક – શૂન્ય		50 પૃષ્ઠ પ્રતિ એસ એમ એસ (દૈનિક/સાપ્તાહિક)
અન્ય ફી	ટીઓડી	ટી ઓ ડી: ભારતીય રૂપિયા 500;			ટી ઓ ડી: ભારતીય રૂપિયા 500;			ટી ઓ ડી: ભારતીય રૂપિયા 500;			ટી ઓ ડી: ભારતીય રૂપિયા 500;			ટી ઓ ડી: ભારતીય રૂપિયા 500;			ટી ઓ ડી: ભારતીય રૂપિયા 500;				
સ્તુત્ય સેવાઓ	ચાલુ વર્ષની પાસબુક (એકાઉન્ટ સ્ટેટમેન્ટને બદલે) બેલેન્સ અને વ્યાજનું સ્ટેટમેન્ટ, સહી ચકાસણી પ્રમાણપત્ર, ફોટો પ્રમાણીકરણ, સરનામાનું પુષ્ટીકરણ, બેલેન્સ અને ઇન્ટરેસ્ટ સ્ટેટમેન્ટ, નેટ બેન્કિંગ / ફોન બેન્કિંગ / ડેબિટ કાર્ડ (કુરિયર દ્વારા મોકલવામાં આવેલ), ખાતું બંધ કરાવવું, ચેકડ / ઇન્સ્ટ્રુમેન્ટ પિક અપ / ડિલિવરી / કેવાયસી પિક અપ	શૂન્ય			શૂન્ય			શૂન્ય			શૂન્ય			શૂન્ય			શૂન્ય				
અન્ય ડેબિટ કાર્ડ સંબંધિત ફી	ખોવાયેલ/ ચોરાયેલ ડેબિટ કાર્ડની ફેરબદલી	ભારતીય રૂપિયા 200			ભારતીય રૂપિયા 200			ભારતીય રૂપિયા 200			ભારતીય રૂપિયા 200			ભારતીય રૂપિયા 200			ભારતીય રૂપિયા 200				
	જારી કરવાનું શુલ્ક	ઇમેજ ડેબિટ કાર્ડ – ભારતીય રૂપિયા 199			ઇમેજ ડેબિટ કાર્ડ – ભારતીય રૂપિયા 199			ઇમેજ ડેબિટ કાર્ડ – ભારતીય રૂપિયા 199			ઇમેજ ડેબિટ કાર્ડ – ભારતીય રૂપિયા 199			ઇમેજ ડેબિટ કાર્ડ – ભારતીય રૂપિયા 199			ઇમેજ ડેબિટ કાર્ડ – ભારતીય રૂપિયા 199				

ફોરેક્સ કાર્ડ		વિગત	નિયત ચાર્જિસ
		ઇશ્યુ કરવાની ફી	250 (GST સિવાય)
		રિતોડ ફી	75 (GST સિવાય)

વિદેશ વિનિમય સેવાઓ (FES)	
વિદેશમાં પ્રેષિત કરાતા નાણાં - વ્યક્તિગત	સ્ટાન્ડર્ડ ચાર્જિસ
ટેલિગ્રાફિક ટ્રાન્સફર ચાર્જિસ (આયાતો માટે ચુકવણી સિવાય)	ભારતીય રૂપિયા 1250 + કરવેરા
કોરરપોન્ડન્સ બેન્ક ચાર્જિસ (વિદેશમાં પ્રેષિત કરાતાં નાણાં જેમાં વિદેશની બેન્કના ચાર્જિસ પ્રેષિત કરનાર દ્વારા ચુકવવામાં આવ્યા છે)	ભારતીય રૂપિયા 1000 + કરવેરા
FCY DD ઇશ્યુ કરવો	ભારતીય રૂપિયા 750 + કરવેરા
વિનિમયના બદલામાં કમિશન (EEFC/RFC/SFC એકાઉન્ટમાંથી થયેલા ઉપાડના કિસ્સામાં)	0.125%; લઘુત્તમ ભારતીય રૂપિયા 1000 + કરવેરા

સુધારેલુ GST માગખું નીચે મુજબ છે	
વિદેશી ચલણની ખરીદી અથવા વેચાણનુ મૂલ્ય	જેની ઉપર GST દર લાગુ પડશે તે મૂલ્ય
ભારતીય રૂપિયા 1,00,000 સુધી	ચલણ વિનિમયની એકંદર રકમના 1% અથવા લઘુત્તમ ભારતીય રૂપિયા 250/
ભારતીય રૂપિયા 1,00,000/– થી વધુ અને ભારતીય રૂપિયા 10,00,000/– સુધી	1000 + 1,00,000 કરતાં ઓછા ચલણ વિનિમયની એકંદર રકમના 0.50%
ભારતીય રૂપિયા 10,00,000/–થી વધારે	ભારતીય રૂપિયા 5500/– + મહત્તમ ભારતીય રૂપિયા 60,000/–ને આધીન 10,00,000 કરતાં ઓછા ચલણ વિનિમયની એકંદર રકમના 0.10%

****1 ને, 2025 થી લાગુ થતા ફેરફારો**

એજ સેવિન્સ, સેલેરી, નોવા સેવિન્સ, સિનજી સેવિન્સ, એવરીડિ સેવિન્સ, સેલેરી, સન્માન સેવિન્સ અકાઉન્ટ, પ્રો સેવિન્સ, કલાસિક સેવિન્સ માટે કંશ ટ્રાન્ઝેક્શન લિમિટ દર મહિને ૩ ટ્રાન્ઝેક્શન્સ અથવા ભારતીય રૂપિયા 1 લાખ જે પછા પહેલા થાય ત્વાં સુધી શૂન્ય.

એવરીડિ સેવિન્સ અકાઉન્ટ, પ્રો સેવિન્સ, કલાસિક સેવિન્સ માટે ચેક બુક ફી- દર વર્ષે 25 ચેક પાનાં સુધી મફત ત્યારબાદ ભારતીય રૂપિયા ૩ પ્રતિ ચેક પાનું.

એસ સેવિન્સ અકાઉન્ટ, કમ્પોસાઈટ સેવિન્સ અકાઉન્ટ માટે ચેક બુક ફી- શૂન્ય

સેવિન્સ પીઓએ પ્રોડક્ટ, ઇન્વેસ્ટમેંટ ઇક્વિસિટ્સ માટે સેવિન્સ અકાઉન્ટ માટે ડીમાન્ડ ડ્રાફ્ટ ફી - ભારતીય રૂપિયા 4/1000 (ઓછામાં ઓછા ભારતીય રૂપિયા 50, વધુમાં વધુ ભારતીય રૂપિયા 10,000), વરિફ નાગરિક માટે ભારતીય રૂપિયા ૩/1000

બેલેન્સીસ વેલ્યુ એકેડ એલફૂસ (દૈનિક/સાપ્તાહિક) એસ સેવિન્સ, સેલેરી, પ્લેટિના સેલેરી, એવરીડે સેવિન્સ, સેલેરી, ચુનિ સેલેરી અકાઉન્ટ, કમ્પોસાઈટ સેવિન્સ અકાઉન્ટ માટે- પ્રતિ એસએસએમ 50 પૈસા (દૈનિક/સાપ્તાહિક)

રેકૉર્ડ રિટ્રાઈવલ (પાછા મેળવવા માટે) ચાર્જિસ / ટીડી/ બીસી કૅન્સલેશન અને રીવેલિડિએશન ચાર્જિસ- હાલ ભારતીય રૂપિયા 100/ ઘટના છે જે સુધારીને શૂન્ય કરાશે.

કોર્પોરેટ પગાર યોજનાઓ માટે ડેબિટ કાર્ડ જારી કરવાની ફી શૂન્ય છે

કોર્પોરેટ પગાર યોજનાઓ માટે દર્શાવેલ ડેબિટ કાર્ડ વાર્ષિક ફી પગાર ક્રેડિટ/એએમબી આવસ્યકતાને આધીન નથી.

પ્રિવી કાર્ડ / Goqii વેરબલ પેમેન્ટ ઉપર દર્શાવ્યા મુજબ દરો લાગુ થઈે

*****માઈગ્રેશન/રીઝેડેશનના કિસ્સામાં

પીવીઆર સેવિન્સ એકાઉન્ટ, એજ સેવિન્સ એકાઉન્ટ સમાન જ છે

કોટક કોમ્પોઝિટ સેવિન્સ એકાઉન્ટ માટેની ફી કોટક એસ સેવિન્સ એકાઉન્ટ સમાન જ છે

ડેબિટ કાર્ડ માટે ઉક્ષેપિત શુલ્ક ઉક્ષેપિત સ્કીમ કોડના ડિફોલ્ટ વર્ગીકરણને આધીન છે. અપગ્રેડ/ ડાઉનગ્રેડ/ વર્ગીકરણ ફેરફારના કિસ્સામાં તેની અસર થશે.

ઓપરરડ્રાફ્ટ કિસ્કડ ડિપોઝિટ ઇન્ડિવિજ્યુઅલ એકાઉન્ટ (ODFDS) અને ઓપરરડ્રાફ્ટ કિસ્કડ ડિપોઝિટ કોર્પોરેટ સેલરી એકાઉન્ટ (ODFDC) માટેની સર્વિસ ફી અનુક્રમે એજ સેવિન્સ એકાઉન્ટ અને એજ કોર્પોરેટ સેલરી એકાઉન્ટ જેવી જ હશે. જો કે, ODFDS અથવા ODFDC માં કોઈ ન્યૂનતમ AMB આવસ્યકતા નથી.

સ્વ–સંચાલિત માર્દનાર સેવિન્સ એકાઉન્ટ માટેની ફી નોવા સેવિન્સ એકાઉન્ટ જેટલી જ છે.

આરબીઆઈબી માર્નેદર્શિકા મુજબ, સેવિન્સ એકાઉન્ટ્સમાં વેપાર/વાણિજ્યિક ટ્રાન્ઝેક્શનોની પરવાનગી નથી.

##અન્ય કોમેસ્ટિક અઝખમાંથી રોકડ ઉપાડની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન ભારતીય રૂપિયા 10000 છે.

#*ઝોચનાં 6 શહેરો – મુંબઈ, નવી દિલ્હી, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદના એ એટી એમમાં થયેલાં ટ્રાન્ઝેક્શન્સ.

કરજિયાત ચેતવણીઓ પર શુલ્ક લેવામાં આવશે નહીં. ચેતવણીઓ કે જે આરબીઆઈ દ્વારા કરજિયાત કરવામાં આવી હોય તેમજ બેંક દ્વારા ચોચ્ચ માનવામાં આવતી ચેતવણીઓ મફત મોકલવામાં આવશે, ભલે દૈનિક/સાપ્તાહિક બેલેન્સ એસએમએસ ચેતવણીઓ સુવિધા સબસ્ક્રાઈબ ન કરી હોય.

ઈન્ફો – નેપાળ રેમિટન્સ સ્કીમ (NEFT ફી):

જો લાભાર્થી નેપાળ એસ બી આઈ બેંક લિમિટેડ (એન એસ બી એલ)માં ખાતું રાખે છે: ભારતીય રૂપિયા 25 પ્રતિ ટ્રાન્ઝેક્શન (તમામ કર સહિત).

જો લાભાર્થી નેપાળ એસ બી આઈ બેંક લિમિટેડ (એન એસ બી એલ)માં ખાતું ન જાળવે તો: ભારતીય રૂપિયા 5000 – ભારતીય રૂપિયા 75 પ્રતિ ટ્રાન્ઝેક્શન સુધી અને ભારતીય રૂપિયા 5000થી વધુ – ભારતીય રૂપિયા 100 પ્રતિ ટ્રાન્ઝેક્શન (તમામ કર સહિત).

બધી સેવાઓ, જ્યાં મફત મર્યાદા નિર્દિષ્ટ કરવામાં આવી છે, મફત મર્યાદાથી વધુ વપરાશ સંબંધિત સેવાના માનક શુલ્ક મુજબ વસૂલવામાં આવશે. < સરેરાશ માસિક બેલેન્સની જાળવણીમાં ડિફોલ્ટની સ્થિતિમાં અથવા બેંક અને ગ્રાહક વચ્ચે મહિના માટે સંમત થયા મુજબ નિયમિત પગારની ક્રેડિટ (‘ડિફોલ્ટ મહિનો’ તરીકે ઓળખવામાં આવે છે), બેંક ગ્રાહકને ડિફોલ્ટ વિશે સ્પષ્ટપણે સૂચિત કરશે અને તે ક્યંાં તો જોવામાં આવનાર પગાર ક્રેડિટ અથવા ખાતા માટે સરેરાશ માસિક બેલેન્સ પછીના મહિનામાં <>('નોટિસ મહિનો' તરીકે ઓળખવામાં આવે છે) મળવાનું રહેશે નહીં તો 'ડિફોલ્ટ મહિનો' અને 'નોટિસ મહિનો' બંને માટે NMC (નોન મેન્ટેનન્સ ફી) પુનઃપ્રાપ્ત કરવું. બેંક એસ એમ એસ/ ઇમેલ/ પત્ર દ્વારા સૂચિત કરવાનું પસંદ કરી શકે છે. માન્ય ઇમિઈલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું હંમેશા બેંક સાથે અપડેટ કરાવવાની જવાબદારી ગ્રાહકની રહેશે, જો તેમ ન થાય તો, ગ્રાહકને સૂચના/સૂચનાઓ પ્રાપ્ત થઈ શકશે નહીં. એન એમ સી ફી, એ એમ બીમાં જોવા મળેલી ઘટ અને જીુ એસ એફ સીમાં સ્લેબમાં નિર્દિષ્ટ કર્યા મુજબ આધારિત હશે.

સિલ્ક ડેબિટ કાર્ડ માટે લાગુ પડતી ફી કલાસિક ડેબિટ કાર્ડ જેવી જ રહેશે. તેના માટે વ્યક્તિગત રીતે હોમ બ્રાન્ચની મુલાકાત લેતા ખાતાધારકોને માસિક ભૌતિક સ્ટેટમેન્ટ મફત આપવામાં આવશે.

બેંક ડેબિટ કાર્ડ્સ પર કરવામાં આવતા વિદેશી ચલણના ટ્રાન્ઝેક્શનો પર ૩.5% નો કોસ–કન્વેસી માર્ક–અપ ચાર્જ વસૂલશે. ઉપયોગમાં લેવાતો વિનિમય દર વિઝા/માસ્ટરકાર્ડ હોલસેલ એક્સચેન્જ દર હશે જે ટ્રાન્ઝેક્શનના સમયે પ્રવર્તતો હોય.

વેપારી આઉલેટ્સ (Cash@PoS) પરથી કરવામાં આવેલ રોકડ ઉપાડનાં ટ્રાન્ઝેક્શનો પર ટ્રાન્ઝેક્શનની રકમ + જીુ એસ ટી પર 1% ચાર્જ (એપ્રિલ 1, 2019થી) ના રોજથી લાગુ થશે.

અપૂરતા ભંડોળને કારણે ASBA મોડ દ્વારા કરવામાં આવેલી અરજીઓમાં કોઈપણ અસ્વીકાર પ્રતિ અસ્વીકાર ભારતીય રૂપિયા ૩50/– ફી વસૂલશે.<>

ન+આંતરરાષ્ટ્રીય એટીએમ ટ્રાન્ઝેક્શન પર અન્ય બેંક દ્વારા વસૂલવામાં આવતી વધારાની ફી પણ કાર્ડ ધારકે ભોગવવી પડશે.

ઉપરોક્ત ફી તમામ ખાતાધારકોને ૩0 દિવસની અગાઉની સૂચના સાથે સુધારણાને આધીન છે, ફીના પુનરાવર્તનને કારણે ખાતું બંધ કરવું એ એકાઉન્ટ ક્લોઝર ફીને આધીન રહેશે નહીં.

કોર્ટુબિક બચત ખાતાને એન એમ સી માફીનો લાભ ત્યાં સુધી જ મળશે, જ્યાં સુધી લિંક કરેલ મુખ્ય પગાર ખાતામાં માસિક પગાર જમા થયા કરે અથવા જરૂરી પ્રોડક્ટ અખઈ જાળવે નહીં. જો પ્રિન્સિપલ સેલેરી એકાઉન્ટમાં પગારની ક્રેડિટ ન મળે અથવા જરૂરી AMB જાળવવામાં ન આવે તો, લિંક કરેલ ફેમિલી સેવિન્સ એકાઉન્ટે ભારતીય રૂપિયા 10000નું **AMB** જળવાવું જોઈએ, જે નિષ્ફળ થવાથી ફેમિલી સેવિન્સ એકાઉન્ટમાં રોજિંદા એકાઉન્ટ (CS PRO)ની કઈ પ્રમાણભૂત ફી લાગુ થશે.

<> પેનલ્ટી ફી. એકવાર ખાતું નિષ્ક્રિય/નિષ્ક્રિય થઈ જાય પછી લાગુ પડતી નથી.

જે ગ્રાહકોએ દૈનિક/ સાપ્તાહિક બેલેન્સ ચેતવણીઓ સુવિધા માટે સબ્સ્ક્રાઇબ કર્યું છે તેમને ટ્રાન્ઝેક્શન અને મૂલ્ય વર્ધિત જમજ ચેતવણીઓ મફતમાં મોકલવામાં આવશે.

ચેતવણીઓ કે જે આરબીઆઈ દ્વારા કરજિયાત કરવામાં આવી છે તેમજ બેંક દ્વારા ચોચ્ચ માનવામાં આવતી ચેતવણીઓ મફત મોકલવામાં આવશે, ભલે દૈનિક/સાપ્તાહિક બેલેન્સ એસએમએસ ચેતવણીઓ સુવિધા સબસ્ક્રાઈબ ન કરી હોય.

ડેબિટ કાર્ડ ફી પગાર ક્રેડિટને આધીન છે.

જો સળંગ ૩ મહિના સુધી પગારની ક્રેડિટ જમા ન થાય, તો અન્ય બેંક એટીએમ પર 5 થી વધુ મફત ટ્રાન્ઝેક્શનો ધરાવતા ખાતાઓને કોર્પોરેટ ઓફરને ધ્યાનમાં લીધા વિના માત્ર 5 ટ્રાન્ઝેક્શનો પર ડાઉનગ્રેડ કરવામાં આવશે. પ્રોગ્રામ ગ્રાહકોને આ કવાયતમાંથી બાકાત રાખવામાં આવશે.

બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શનો બેલેન્સ પૂછપરછ, મિની સ્ટેટમેન્ટ અને પિન ચેન્જ છે

ડેબિટ કાર્ડ જુનિયર, યુથ અને મેસ્ટ્રો ડેબિટ કાર્ડ્સ માટેની વાર્ષિક ફી કલાસિક ડેબિટ કાર્ડ જેટલી જ રહેશે.

મહેરનાની કરીને નોંધ લેશો કે કેશ પિકઅપ/ ડિલિવરી ફી ગ્રાહકને ઓફર કરવામાં આવતી કેશ પિક–અપ/ડિલિવરી સેવાથી સંબંધિત છે. રોકડ ટ્રાન્ઝેક્શનો માટે વધારાની ફી સંબંધિત વેરિઅન્ટ હેઠળ ઓફર કરાયેલ રોકડ ટ્રાન્ઝેક્શન મર્યાદાના આધારે વસૂલવામાં આવશે. રોકડ પિક–અપ રકમ વેરિઅન્ટ હેઠળ ઓફર કરવામાં આવતી એકંદર રોકડ ટ્રાન્ઝેક્શન મર્યાદાનો એક ભાગ હશે.

S2W SELECT ઓફર સાથે કોર્પોરેટ પગાર ખાતા માટે, તમારા ખાતામાં શૂન્ય બેલેન્સ સુવિધા નિયમિત માસિક પગાર ક્રેડિટ અથવા માત્ર NEFT/RTGS દ્વારા દર મહિને ઓછામાં ઓછા ભારતીય રૂપિયા 10,000ના સિંગલ ક્રેડિટ ટ્રાન્ઝેક્શનને આધીન છે (રોકડ ડિપોઝિટ, ચેક ડિપોઝિટ અને કોઈપણ અન્ય પાસેથી ફંડ ટ્રાન્સફર કોટક બેંક એકાઉન્ટ ધ્યાનમાં લેવામાં આવશે નહીં). જો પગાર/ફંડ જમા ન થાય તો, તમારે એકાઉન્ટની સુવિધાઓ ચાલુ રાખવા અને નોન મેન્ટેનન્સ ફી ટાળવા માટે પ્રોડક્ટ વેરિઅન્ટ મુજબ સરેરાશ માસિક બેલેન્સ (AMB) જાળવવું જરૂરી છે. બેંક એસ એમ એસ/ઇમેલ/પત્ર દ્વારા સૂચિત કરવાનું પસંદ કરી શકે છે. માન્ય ઇમિઈલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું હંમેશા બેંક સાથે અપડેટ કરાવવાની જવાબદારી ગ્રાહકની રહેશે, જો તેમ ન થાય તો, ગ્રાહકને સૂચના પ્રાપ્ત થઈ શકશે નહીં. ગખઈ ફી એએમબીમાં જોવા મળેલી ખામી અને GSFCમાં સ્લેબમાં નિર્દિષ્ટ કરેલ ખામી પર આધારિત હશે.

ફી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સિવાયની છે.

1 જુલાઈ, 2017 થી અસરકારક માલ અને સેવા કર દર કરપાત્ર મૂલ્ય પર 18% રહેશે. GST દર સમયાંતરે બદલાતા રહે છે.

રાજ્ય સરકારના કર/સેસ લાગુ પડશે

1લી જુલાઈ, 2020ના રોજથી; ઐશોલ્ડ તેમજ રોકડ ઉપાડ માટે લાગુ પડતા TDS નો દર આવકવેરા રિટર્ન ફાઈલ કરવાના પુરાવા સબમિટ કરવા પર નિર્ભર રહેશે. સુધારેલા TDS દરો નીચે મુજબ હશે:

બચત અને કોર્પોરેટ પગાર નોંધો પર વિગતવાર માહિતી માટે www.Kotak.com ની મુલાકાત લો ફી અને ફી (GSFC) સામાન્ય શેડયૂલ સુવિધાઓ અને ફીની મહત્વની નોંધો – બચત અને કોર્પોરેટ પગાર ખાતાઓ માટે લિન્ક : https://www.kotak.com/ content/ dam/ Kotak/ others/ important- notes- of general- schedule- features.pdf

લાગુ પડતા હોય તદનુસાર રાજ્ય સરકારના કર / સેસ

ચાર્જ કરવામાં આવશે. 1લી સપ્ટેમ્બર 2019 થી, નાણાકીય વર્ષ દરમિયાન કરવામાં આવેલ કુલ એક કરોડ રૂપિયાથી વધુની રોકડ ઉપાડ પર 2% (વત્તા લાગુ સરચાર્જ એસ સેસ) ના દરે TDS કાપવામાં આવશે.

^જો સળંગ 4 મહિના સુધી કોઈ પગાર જમા ન થયો હોય, તો ખાતાને સેવિન્સ એકાઉન્ટ વેરિઅન્ટમાં પરિવર્તિત કરવામાં આવશે. સંબંધિત એકાઉન્ટ વેરિઅન્ટ મુજબ AMB આવસ્યકતા, વિશિષ્ટતાઓ, લાભો તથા શુલ્ક લાગુ થઈે.

#જો સળંગ 6 મહિના સુધી કોઈ પગાર જમા ન થયો હોય, તો ખાતાને સેવિન્સ એકાઉન્ટ વેરિઅન્ટમાં પરિવર્તિત કરવામાં આવશે. સંબંધિત એકાઉન્ટ વેરિઅન્ટ મુજબ AMB આવસ્યકતા, વિશિષ્ટતાઓ, લાભો તથા શુલ્ક લાગુ થશે.

મુંબઈ ઇન્ટરબેંક ઓફર કરેલા દર – ફ્લોટિંગ રેટ લિંકડ સેવિન્સ સ્કીમ માટેના તમામ શુલ્ક શૂન્ય રહેઈે.

1લી જુલાઈ, 2020ના રોજથી; ઐશોલ્ડ તેમજ રોકડ ઉપાડ માટે લાગુ પડતા TDS નો દર આવકવેરા રિટર્ન ફાઈલ કરવાના પુરાવા સબમિટ કરવા પર નિર્ભર રહેશે. સુધારેલા TDS દરો નીચે મુજબ હશે:

1લી નવે. 24થી અમલી 1%ની કાયબેમિક કરન્સી કન્વર્ઝન (ડીસીસી) માર્ક–અપ ફી વત્તા જીએસટી તમારા કોટક બેન્ક ડેબિટ કાર્ડ પર નિમ્નાલિખિત માટે લાગુ થઈે: આંતરરાષ્ટ્રીય સ્થળે ભારતીય રૂપિયામાં (ભારતીય રૂપિયામાં)માં કરાયેલી લેણદેણ અથવા આંતરરાષ્ટ્રીય સ્થળે નોંધણીકૃત પરંતુ ભારતમાં સ્થિત વેપારીઓ સાથે (ભારતીય રૂપિયામાં)માં કરાયેલી લેણદેણ. ડીસીસી માર્ક–અપ ફી સર્વ એટીએમ, પીઓએસ/ઇન–સ્ટોર અથવા ઓનલાઇન લેણદેણ પર લાગુ થશે.

નાણાકીય વર્ષમાં તમામ એકાઉન્ટમાં એકંદર રોકડ ઉપાડો	બેન્કમાં આવકવેરા રિટર્નની નકલ જમા કરવાની સ્થિતિમાં	બેન્કમાં આવકવેરા રિટર્નની નકલ જમા નહીં કરવાની સ્થિતિમાં
ભારતીય રૂપિયા 20 લાખ સુધી	શૂન્ય	શૂન્ય
ભારતીય રૂપિયા 20 લાખથી રૂ.1 કરોડ	શૂન્ય	2%@
ભારતીય રૂપિયા 1 કરોડથી વધારે	2%@	5%@

જો ખાતામાં PAN અપડેટ કરવામાં આવ્યું નથી, તો આવકવેરા કાયદાની કલમ 206અઅ મુજબ 20% ના દરે TDS લાગુ થશે. વિદેશી કંપનીઓ, વિદેશી ભાગીદારી પેઢીઓ માટે, બિન–નિવાસી વધારાના સરચાર્જ અને આરોચ્ય અને શિક્ષણ ઉપકર આવકવેરા કાયદા મુજબ લાગુ થઈે.